

પોઝીટીવ પે સીસ્ટમ ફોર CTS

ઉપરોક્ત બાબતે જણાવવાનું કે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો “પોઝીટીવ પે સીસ્ટમ ફોર સીટીએસ” બાબતનો પરિપત્ર નંબર: RBI / ૨૦૨૦ – ૨૧ / ૪૧ , DPSS.CO.RPPD.No. ૩૦૯ / ૦૪.૦૭.૦૦૫ / ૨૦૨૦-૨૧ તા. ૨૫.૦૯.૨૦૨૦, માં જણાવ્યા મુજબ બેંકના ગ્રાહકોના નાણાની સલામતી અને ચેક દ્વારા થતા ફોંડ નિવારવા માટે “ પોઝીટીવ પે સીસ્ટમ ફોર સીટીએસ “ નો નવો કન્સેપ્ટ તા. ૦૧.૦૧.૨૦૨૧થી અમલમાં મુકવામાં આવેલ છે.

આ અંતર્ગત:::

- ગ્રાહક દ્વારા ઇસ્યુ કરાયેલ ચેકની માહિતી, ગ્રાહક દ્વારા પોતાની બેંકને આપવાની રહેશે. જેમ કે ચેક નંબર અને ઇસ્યુ કર્યાની તા., ચેક ની રકમ, પેચીનું નામ..
 - CTS માં તે ચેક પાસ થવા માટે રજુ થાય ત્યારે તે ચેકની વિગતો ગ્રાહકે પૂરી પડેલી માહિતી સાથે સરખાવવામાં આવશે અને ત્યારબાદ જે તે ચેક પાસ – ક્લીયર કરવાની પ્રોસેસ થશે.
 - રૂ. ૫૦,૦૦૦ કે તેથી વધુ પરંતુ રૂ. ૫ લાખ ની અંદરની રકમના ચેક માટે આ કન્સેપ્ટ હાલમાં આ ગ્રાહકો માટે ફરજિયાત નહિ રહે, રૂ. પરંતુ ૫ લાખ કે તેથી વધુ રકમના ચેક માટે ગ્રાહકે ફરજિયાત જાણ કરવાની રહે છે.
- આ કન્સેપ્ટ મુજબ ગ્રાહક દ્વારા રૂ. ૫ લાખ કે તેથી વધુ રકમના ચેક ઇસ્યુ કરવામાં આવે ત્યારે તેઓએ ADC બેંકની પોઝીટીવ પે સીસ્ટમ માટેની મોબાઇલ એપ્લિકેશન દ્વારા ચેક ઇસ્યુ કર્યાની માહિતી ભરવાની રહેશે. ADC બેંકની પોઝીટીવ પે સીસ્ટમ માટેની મોબાઇલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં ADCB Positive Pay સર્ચ કરી ડાઉનલોડ કરવી.



ADCB Positive Pay
CedgeTechno • Finance
5.0 ★ 2.8 MB

એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખવાથી OTP આવશે. OTP વેરીફાય થયા બાદ તે મોબાઇલ સાથે સંકળાયેલા તમામ ખાતા દર્શાવશે. ત્યાર બાદ તેમાં ડેટા અપલોડ કરી શકાશે.

- ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા માહિતી અપલોડ કરવામાં અસમર્થ હોય ત્યારે ચેકની માહિતી અપલોડ કરવા માટે નીચે જણાવેલ લિંક પર ક્લિક કરવી.

ચેકની માહિતી અપલોડ કરો

આ લિંકમાં પ્રથમ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા OTP જનરેટ કર્યા બાદ ચેક ઇસ્યુ કર્યાની માહિતી ભરવાની રહેશે.

- ગ્રાહક પાસે સ્માર્ટ ફોન અથવા ઇન્ટરનેટની સુવિધા ન હોય તેવા સંજોગોમાં ગ્રાહકે નજીકની શાખામાં ચેક ઇસ્યુ કર્યાની માહિતી આપવાની રહેશે.

આ બાબત અંગે વધુ માર્ગદર્શન માટે શાખા મેનેજર નો સંપર્ક કરવો.